


# ॥ શ્રીવલલભચરિત્ર ॥

● પ્રકાશિત ●  
પુષ્ટિ પબ્લિકેશન - જૂનાગઢ



॥ શ્રીવલ્લભચિત્ત્ર ॥



# ॥ શ્રીવલ્લભચિત્ત્ર ॥

લેખન/સંકલન

ગોસ્વામી શ્રીપીયુષ્ટુમારજી મહોદય  
મોટી હવેલી - જૂનાગઢ.

ચિત્રરચના

ગોસ્વામી સૌ. શ્રીપદશ્રીવહુજી  
મોટી હવેલી - જૂનાગઢ.

પ્રતિ

૨૦૦૦

પ્રકાશન વર્ષ

શ્રીકૃષ્ણાબદ ૫૨૩૮, શ્રીવલ્લભાબદ ૫૩૭, વિકમ સંવત् ૨૦૧૦, ઈ.સ. ૨૦૧૪

ન્યોધાવર

રૂ. ૨૦

પ્રાપ્તિસ્થાન

શ્રીપુષ્ટિસંસ્કાર સંસ્થાન, મોટી હવેલી, જૂનાગઢ

મુદ્રણ/પ્રકાશન સંયોજન :

પુષ્ટિ પબ્લિકેશન - જૂનાગઢ

ફોન : ૦૨૮૫ - ૨૬૨૧૧૧૧, મો. ૯૬૩૮૦ ૨૬૪૫૬

[www.pushtipublication.com](http://www.pushtipublication.com)

© સર્વ હક્ક પ્રકાશકને આધિન.



# ॥ શ્રીવલ્લભચરિત્ર ॥



પુષ્ટિભક્તિમાર્ગ-પ્રવર્તક સાકારબ્લેન્ડ-સ્થાપક આચાર્યવર્ય  
શ્રીમહાપ્રભુજી શ્રીવલ્લભાચાર્યજી



## આમુખ



આપણી ધર્મનિર્ઝઠનો આધાર આપણા ગુરુવર્ય શ્રીવલ્લભચયાર્તજીનો ઉપદેશ છે. આપણા પથદર્શક શ્રીવલ્લભચયાર્તચરણના ચારિત્રનું જીબન પ્રાપ્ત થાય અને આચાર્યચારિત્રના ભાવન દ્વારા આપણામાં વૈષ્ણુતાના સંસ્કારોનું સહજ પ્રવર્તન થાય તે માટે 'શ્રીવલ્લભચયાર્ત'નું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. બાળકો તથા સર્વને વિશેષ ઉત્સાહ થાય તે માટે સુંદર રંગીન ચિત્રોથી પુસ્તિકાને સજ્જ કરવામાં આવી છે.

અમારો આ અલ્પ પ્રયાસ શ્રીવલ્લભના ચરણકુમલમાં સમર્પિત કરીએ છીએ.

ગોસ્વામી શ્રીપીયુષ્ટકુમારજી મણોદ્ય  
ગોસ્વામી સૌ. શ્રીપદશ્રીવહુજી

## અનુક્રમણિકા

- શ્રીવલ્લભચયાર્તજીના પૂર્વજો ૪
- શ્રીવલ્લભચયાર્તજીનું ગ્રાન્ટ્ય ૪
- શ્રીવલ્લભચયાર્તજીનું બાલપણ ૫
- જગન્નાથપુરીમાં શ્રીવલ્લભનો પ્રભાવ ૭
- ગ્રાં પૃથ્વી (ભારત) પરિક્રમા ૮
- ભગવાનું શ્રીકૃષ્ણ દ્વારા દીક્ષામન્ત્રનું પ્રદાન ૧૦
- શ્રીનાથજીનું ગ્રાન્ટ્ય ૧૧
- શ્રીસુદોધિનીલેખન તથા અન્ય ગ્રન્થો ૧૩
- શાસ્ત્રાર્થમાં વિજય અને કનકાભિષેક ૧૪
- સ્વમતસ્થાપન તથા પત્રાવલંબનની રચના ૧૫
- શ્રીવલ્લભચયાર્તજીનો પરિવાર ૧૬
- શ્રીપુરુષોત્તમસહસ્રામની રચના ૧૮
- શેઠ પુરુષોત્તમદાસને ત્યાં નન્દમહોત્સવ ૧૯
- શ્રીદ્વારિકાધીશજીનું ગ્રાન્ટ્ય ૨૦
- ભગવન્નામનું માહિત્ય ૨૧
- શ્રીવલ્લભચયાર્તજી વૈષ્ણવો માટે સદા બિરાજે છે ૨૧





## શ્રીવલ્લભાચાર્યજીના પૂર્વજી


શ્રીવલ્લભાચાર્યજીના પૂર્વજી શ્રીયજ્ઞનારાયણભહૃજુ દક્ષિણ ભારતના કાંકુંભકર (કંકરવાડ) ગામમાં રહેતા હતા. તેઓ સાત્ત્વિક સદાચારી બ્રાહ્મણ હતા અને શાસ્ત્રોના ઉત્તમ જ્ઞાતા વિદ્વાનું હતા.

તેઓ કુલપરમપરા અનુસાર સોમયજ્ઞ કરતા. વેદમાં કહ્યું છે ‘યજ્ઞો વૈ વિષણુः’ એટલે કે ‘યજ્ઞ; ભગવાન્નં સ્વરૂપ છે’. એક વખત ભગવદ્ભાવથી શ્રીયજ્ઞનારાયણજી; સોમયજ્ઞ કરી રહ્યા હતા ત્યારે યજ્ઞકુંમાંથી સાક્ષાત્ ભગવાન્ શ્રીકૃષ્ણ; મદનમોહનજી સ્વરૂપે પ્રકટ થયા. શ્રીયજ્ઞનારાયણજીએ અત્યન્ત પ્રસન્ન થઈને પ્રભુને દંડવત્ પ્રાણામ કર્યા.

ભગવાન્ શ્રીકૃષ્ણા; શ્રીયજ્ઞનારાયણજીને વરદાન આપ્યું કે “આપના કુલમાં ૧૦૦ સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું અવતાર ધારણ કરીશ”

આ રીતે ભૂતલ પર સન્માર્ગના  
ઉપદેશ માટે પ્રભુએ; ઉત્તમ કુલમાં  
આચાર્યસ્વરૂપે સ્વયં પ્રકટ થવાનો નિર્ધાર કર્યો.

શ્રીયજ્ઞનારાયણભહૃજુએ પોતાના જીવનકાલમાં ઉર સોમયજ્ઞ કર્યા. ત્યાર પછી તેમની વંશપરમપરામાં શ્રીગંગાધર ભહૃજુએ ૨૮, શ્રીગણપતિ ભહૃજુએ ૩૦, શ્રીવલ્લભ ભહૃજુએ પાંચ અને શ્રીલક્ષ્મણ ભહૃજુએ પાંચ સોમયજ્ઞ કર્યા. આ રીતે શ્રીલક્ષ્મણભહૃજુના સમયમાં ૧૦૦ સોમયજ્ઞ પૂર્ણ થયા.



## શ્રીવલ્લભાચાર્યજીનું પ્રાકટ્ય

૧૦૦ સોમયજ્ઞ પૂર્ણ થયા પછી શ્રીલક્ષ્મણભહૃજુ; પ્રભુના અવતરણની પ્રતીક્ષા કરવા લાગ્યા. તેઓ પોતાના પત્ની શ્રીઈલક્ષ્માગર્જુ અને પોતાના કેટલાક આત્મીયજ્ઞનોને સાથે લઈને દક્ષિણ ભારતથી ઉત્તર ભારત તરફ આવ્યા. શ્રીલક્ષ્મણભહૃજુ પોતાના આત્મીયજ્ઞનો સાથે થોડો સમય કાશીમાં રહ્યા; ત્યાં સમાચાર આવ્યા કે આક્મણગારીઓ કાશી પર આક્મણ કરવા આવી રહ્યા છે. તેથી પોતાના



## ॥ શ્રીવલ્લભચાર્યિત્ર ॥



પરિવાર અને આત્મીયજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને; તેઓ કાશી છોડીને અન્ય સ્થાનમાં જવા નીકળ્યા.

તે વખતે શ્રીઈલમ્માગારુજી ગર્ભવતી હતા. રસ્તામાં ચમ્પારણ્ય નામના વનમાં શ્રીઈલમ્માગારુજીને સમય પહેલા પ્રસવ થયો. બાલક નિષ્ઠેતન જણાતા, અત્યન્ત વ્યથિત હદ્દે એક વૃક્ષ નીચે તે બાલક રાખીને ઉપર પાંદડા ઢાંડીને તેઓ આગળ વધ્યા.



આગળ જઈને એક સ્થાનમાં રાત્રિવિશ્રામ કર્યો; ત્યાં સ્વર્ણમાં ગ્રલ્બું આશા કરી ‘હું આપની રાહ જોઉં હું આપ મને મૂકીને આગળ ન જાવ’

તરત જ અત્યન્ત આતુરતાથી તેઓ પાછા વજ્યા અને જ્યાં પોતાના બાલકને પદ્ધરાયા હતા તે શમીના વૃક્ષ નીચે જઈને જોયું તો આસપાસ અનિ પ્રજ્વલિત હતો અને વચ્ચે બાલ શ્રીવલ્લભ પ્રસન્નમુદ્રામાં પોઢી રહ્યા હતા. માતાશ્રીનું દેત છલકાઈ આવ્યું, અનિએ તેમને માર્ગ આપ્યો તેઓએ ઢોડીને પોતાના પુત્રને ઉપાડી લીધા.

આમ શ્રીવલ્લભાચાર્યજીનું પ્રાકટ્ય; માતાશ્રી શ્રીઈલમ્માગારુજી અને પિતાશ્રી શ્રીલક્ષ્માણભડુજી ને ત્યાં ચૈત્ર વદ એકાદશી સંવત् ૧૫૩૫, રવિવારના દિવસે ચમ્પારણ્યમાં થયું.

### શ્રીવલ્લભાચાર્યજીનું બાલપણ

શ્રીવલ્લભ બાલ્યાવસ્થાથી જ અત્યંત પ્રતિભાશાળી હતા. શ્રીવલ્લભ બોલતા શીખ્યા ત્યાર પછી વારંવાર પિતાશ્રીના કક્ષમાં પદ્ધારતા.

વિદ્વાન् પંડિતો બેઠા હોય અને શાસ્ત્રચર્ચાઓ થતી હોય; ત્યાં બિરાજ ચર્ચાઓ સાંભળતા અને વાણીવાર તો કોઈ પ્રશ્નનું સમાધાન ન મળે તો પોતાની બાલવાણીમાં ઓછા શબ્દોમાં ઉકેલ આપી દેતા. પંડિતો નવાઈ પામી જતા અને શ્રીલક્ષ્માણભડુજીને કહેતા, ‘આપના પુત્ર તો વાક્યપતિ (વાણીના સ્વામી) છે.’

આ રીતે શ્રીવલ્લભ બાલપણથી જ અત્યન્ત મેધાવી હતા.

શ્રીલક્ષ્માણભડુજી પાસે એક સુંદર હષપુષ ગાય હતી. તેનું નામ હતું ‘પયોદા’.

## ॥ શ્રીવલ્લભચારિત્ર ॥

શ્રીવલ્લભને પયોદા અત્યન્ત પ્રિય હતી.

એક દિવસ બાળ શ્રીવલ્લભે બધાને વાડામાં ભેગા થયેલા જોયા. સહુના મુખ પર કુઃખની લાગણી હતી.

શ્રીવલ્લભે પૂછ્યું ‘આપ બધા ઉદાસ કેમ છો ?’

પિતાશ્રીએ જવાબ આપ્યો ‘પુત્ર ! આપણી માનીતી ગાય પયોદા મરાણ પામી છે.’

શ્રીવલ્લભ નિશ્ચેતન ગાય પાસે પધાર્યા અને ગાયની પીઠ પર પોતાના વાત્સલ્યસભર કોમલ શ્રીહસ્ત ફેરવીને કહ્યું, ‘પયોદા ! ઉઠો.’

આમ બોલતા જ જાણે ભર ઉઘમાંથી આણસ મરડીને ઉભી થતી હોય તેમ પયોદા ઉભી થઈ ગઈ. સૌ નવાઈ પામ્યા.

માતા શ્રીહલમજીએ વલ્લભને ગોદમાં ઉચ્ચકી લીધા અને વાલથી મસ્તક પર હાથ ફેરવવા લાગ્યા. આ રીતે વિવિધ બાલકીડાઓ કરતા કરતા શ્રીવલ્લભ મોટા થતા હતા.

પાંચ વર્ષની વયમાં ઉત્તમ મુહૂર્ત જોઈને; શ્રીલક્ષ્મણ ભટ્ટજીએ ચૈત્ર વદ્દ ૬, રવિવારના દિવસે શ્રીવલ્લભના યજોપવીત સંસ્કાર કરાવ્યા.

થોડો સમય શ્રીવલ્લભને પિતાશ્રી લક્ષ્મણ ભટ્ટજીએ શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો અને ત્યાર પછી વિદ્વાન् બ્રાહ્મણો પાસે વિદ્યાભ્યાસ માટે મોકલ્યા.

માત્ર આઠ વર્ષની નાની વયમાં જ આપે સમ્પૂર્ણ વેદ, પુરાણ, સ્મૃતિ વગેરે ધર્મશાસ્ત્રો તેમજ સાંખ્ય, યોગ, ન્યાય, મીમાંસા, જૈન, બૌધ્ધ વગેરે વિભિન્ન મતોનો અભ્યાસ પૂર્ણ કર્યો.

આપશ્રીની અગાધ વિદ્વત્તા જોઈ સહુ કોઈ આશ્ચર્ય પામતા અને આપને ‘બાલસરસ્વતી’ કહેતા.



॥ શ્રીવલ્લભચિત્ત્ર ॥



## જગન્નાથપુરીમાં શ્રીવલ્લભનો પ્રભાવ

ભારતભ્રમણ કરતા  
કરતા શ્રીવલ્લભ જગન્નાથપુરી  
માં પદ્ધાર્યા. જ્યારે શ્રીવલ્લભ  
શ્રીજગન્નાથજીના મંદિરની  
પાસે પદ્ધાર્ય ત્યારે ત્યાંના  
કોઈક પંડાએ આપશ્રીને  
શ્રીહસ્તમાં પ્રભુનો મહાપ્રસાદ  
આપ્યો. તે દિવસે એકાદશી  
હતી અને શ્રીવલ્લભનો તો



નિયમ હતો કે એકાદશીના દિવસે જલ પણ ન લેવું. તેથી શ્રીવલ્લભે તે મહાપ્રસાદને  
શ્રીહસ્તમાં જ રાખીને વેદ - પુરાણ વગેરેમાં જ્યાં જ્યાં પણ મહાપ્રસાદના માહાત્મ્યના  
શ્લોક છે તે સર્વ શ્રીમુખથી ઉચ્ચાર કરવા લાગ્યા.

એમ કરતા કરતા એકાદશીનો દિવસ તથા રાત્રિ વ્યતીત થયા અને બીજા દિવસે  
સવારે આપે મહાપ્રસાદ ગ્રહણ કર્યો. ત્યારે ત્યાં શ્રીજગન્નાથપુરીમાં શ્રીવલ્લભની વિદ્રતા  
અને માહાત્મ્ય જોઈને સર્વ લોકો કહેવા લાગ્યા ‘આપશ્રી તો સાક્ષાત् ઈશ્વર છે.  
મનુષ્યદેહમાં આવી વિદ્યા ન હોય. ચાર વેદ, અઢાર પુરાણ સર્વ શાસ્ત્ર આપને જીવણ  
છે.’

તે સમયે જગન્નાથપુરીમાં રાજા ભોજદેવ હતા. તેમણે પણ આ ચર્ચા સાંભળી.

તેથી તેણે આવીને શ્રીવલ્લભભાચાર્યજીના દર્શન કર્યું ‘મારા ઘણા  
ભાગ્ય છે કે મને આપના દર્શન થયા. અમારે ત્યાં વૈષ્ણવ સમ્પ્રદાય અને માયાવાદીઓ  
વચ્ચે ઘણો વિવાદ છે. તેનું કોઈ સમાધાન થતું જ નથી. આપનું જ સામર્થ્ય છે; તેથી  
આપ કંઈક ઉપાય કરો.’

શ્રીવલ્લભે કહ્યું ‘તમારી ઈચ્છા પ્રભુ અવશ્ય પૂર્ણ કરશો. તમારે ત્યાં જેટલા પણ  
બ્રાહ્મણો છે તેમને બધાને એકત્રિત કરો અને જે મોટા મોટા પંડિત હોય તે અમારી સાથે  
આવીને ચર્ચા કરે.’

ત્યારે રાજાએ બધા બ્રાહ્મણોને બોલાવ્યા. બધા જ બ્રાહ્મણો શ્રીજગન્નાથજીના  
મંદિરમાં ભેગા થયા. રાજા ભોજદેવ પણ સભામાં આવ્યા.



શ્રીવલ્લભાચાર્યજી પણ સભામાં પદ્ધાર્ય. સર્વને આપના એવા દર્શન થયા જાણે કે સાક્ષાત્ સૂર્ય - અભિનો તેજોમય પુંજ હોય.

ત્યાર પછી વિદ્વાનો આપશ્રી સાથે શાસ્ત્રચર્ચા કરવા લાગ્યા. પંડિતો જે જે યુક્તિ લગાડે શ્રીવલ્લભ તેનું ખંડન કરે. ઘણો લાંબો સમય ચર્ચા ચાલી. પંડિતો ઉત્તર ન આપી શકે છતાં પણ પરાજ્ય માનવા તૈયાર ન થયા. કેમ કરીને ચર્ચાનો અન્ત ન આવ્યો.

ત્યારે શ્રીવલ્લભે કહ્યું ‘આપણા વાદનું સમાધાન શ્રીજગન્નાથજી ભગવાન્ પાસેથી જ મેળવીએ. તેઓશ્રી જે લખી આપે તે જ સત્ય.’

ત્યારે રાજા અને બ્રાહ્મણોએ કહ્યું, ‘શ્રીજગન્નાથજી કેવી રીતે લખશે ?’

શ્રીવલ્લભે કહ્યું, ‘શ્રીજગન્નાથજીની સામે કોરો કાગળ અને લેખની-સાહીનો ખડિયો ધરી આવો અને દ્વાર બંધ કરો.’

ત્યાર પછી આપશ્રીએ કાગળ પર ચાર પ્રશ્નો લખ્યા -

- (૧) પરમાર્થના સાધનરૂપ મુખ્ય શાસ્ત્ર કહ્યું ?
- (૨) મુખ્ય સેવ્ય દેવ કયા ?
- (૩) મુખ્ય મન્ત્ર કયો ?
- (૪) મુખ્ય ધર્મ (કર્મ) કયો ?

આ પ્રશ્નો લખેલો કાગળ સર્વને બતાવીને શ્રીવલ્લભે રાજાને આપ્યો અને રાજાએ શ્રીજગન્નાથજી સમુખ એ કાગળ અને સાથે કોરો કાગળ તેમ જ કલમ-ખડિયો મૂકી મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા.

થોડા સમય પછી દ્વાર ખોલતા; ચારેય પ્રશ્નોના ઉત્તર રૂપે; શ્રીજગન્નાથજી પ્રભુએ એક શલોક લખી આપ્યો હતા. જે આ પ્રમાણે હતો.

**એક શાસ્ત્રં દેવકીપુત્રગીતમ્ એકો દેવો દેવકીપુત્ર એવ ।**

**મન્ત્રોપ્યેકસ્તસ્ય નામાનિ યાનિ કર્માપ્યેકં તસ્ય દેવસ્ય સેવા ॥**

- |                                |                                 |
|--------------------------------|---------------------------------|
| (૧) સર્વ શાસ્ત્રોના સાર રૂપ છે | - ભગવાન્ શ્રીકૃષ્ણએ કહેલી ગીતા, |
| (૨) સર્વોપરી દેવ છે            | - ભગવાન્ શ્રીકૃષ્ણ,             |
| (૩) મુખ્ય મન્ત્ર છે            | - ભગવાન્ શ્રીકૃષ્ણના નામ,       |
| (૪) શ્રેષ્ઠ કર્મ પણ            | - ભગવાન્ શ્રીકૃષ્ણની સેવા જ છે. |

આ રીતે શ્રીવલ્લભાચાર્યજી દ્વારા કહેવાયેલા સિદ્ધાન્તને ભગવાન્



## ॥ શ્રીવલ્લભચાર્યજી ॥




શ્રીજગન્નાથજીએ પણ સર્વ પંડિતોની સામે પૂર્ણ સમર્થન આપ્યું.

શ્રીજગન્નાથજીના ઉસ્તાક્ષર જોઈને સર્વજનો અત્યન્ત પ્રસન્ન થયા. અને બોધ્યા ‘આ વચન અમારા માટે સર્વોપરી માન્ય છે.’ સહુજનો શ્રીવલ્લભભાચાર્યજીની સ્તુતિ કરવા લાગ્યા કે ‘ધન્ય છે શ્રીવલ્લભ ! આપશ્રી જે કહે છે તે સાક્ષાત્ ભગવાન્ પણ કરે છે.’

રાજા ભોજદેવે કહ્યું કે ‘આપ સાક્ષાત્ ઈશ્વર છો. આપશ્રી વિના આ વિવાદનો કોઈ સમાધાન ન કરી શકત.’

આ રીતે વિભિન્ન મતના વિદ્વાનો, રાજાઓ અને ધાર્મિક જનસમુદ્દાય; શ્રીવલ્લભભાચાર્યજીની બહુમુખી પ્રતિભા અને તેજસ્વી વ્યક્તિત્વથી પરિચિત અને પ્રભાવિત થયા હતા.

આમ બાલ્ય-અવસ્થાથી જ સમસ્ત ભારતમાં શ્રીવલ્લભભાચાર્યજીનો યશ પ્રસરી રહ્યો હતો.



## ત્રણ પૃથ્વી (ભારત) પરિક્રમા

શ્રીવલ્લભભાચાર્યજીના ભૂતલ પર પ્રકટ થવાના મુખ્ય ત્રણ કારણો હતા.

- (૧) ગ્રભુના કૃપાપાત્ર દૈવી પુષ્ટિજીવોને ગ્રભુની પ્રાપ્તિનો માર્ગ બતાવવો.
- (૨) શ્રીમદ્ભાગવતના વાસ્તવિક અર્થને પ્રકટ કરવો.
- (૩) સાકાર બ્રહ્મવાદ (શુદ્ધાક્રૈત મત)નું સ્થાપન કરવું.

દૈવીજીવોના ઉદ્ધાર અને શાસ્ત્રોના સાચા અર્થને લોકમાં સ્થાપિત કરવા માટે શ્રીવલ્લભભાચાર્યજીએ ખૂબ જ નાની વયથી ભ્રમણ કરવાનો પ્રારંભ કર્યો. સમ્પૂર્ણ ભારતના વિવિધ ક્ષેત્રોમાં આપશ્રી પદ્ધાર્ય, અનેક ધર્મનિષ્ઠ જીવો આપશ્રીના દિવ્ય

વ્યક્તિત્વ અને સુંદર સરલ પ્રામાણિક સિદ્ધાન્તોથી પ્રભાવિત થઈને આપશ્રીને શરાણો આવ્યા.

શ્રીવલ્લભ જ્યાં પણ પદ્ધારતા ત્યાં ગામની બહાર જ વૃક્ષ નીચે એકાંતમાં મુકામ કરતા. શેત ધોતી - ઉપરણો ધારણ કરતા. દ્રવ્ય સંગ્રહ ન કરતા. આપશ્રીનું





જીવન અત્યન્ત સાત્ત્વિક હતું.

આપશ્રીએ પોતાના શિષ્યોને ભગવાન् શ્રીકૃષ્ણની શરણાગતિ અને ભક્તિ નો ઉપદેશ આપ્યો અને તે પ્રમાણે જીવન જીવવાની પ્રેરણા આપી.

આ રીતે શ્રીવલ્લભે ત્રણ વખત ખુલ્લા ચરણારવિનંદથી સમ્પૂર્ણ ભારતની પરિકમા કરી.

શ્રીવલ્લભાચાર્યજી ; ભારત પરિકમા દરમ્યાન શ્રીબદ્રિનાથજી - વ્યાસગુફા (ભારતનો ઉત્તર ભાગ) થી લઈને રામેશ્વરમ્ (ભારતનો દક્ષિણ ભાગ ) તેમ જ બેટ દારકા (ભારતનો પશ્ચિમ ભાગ) થી ગંગાસાગર (ભારતનો પૂર્વ ભાગ ) સુધી પદ્ધાર્યા.

આટલા મોટા વિસ્તારમાં જુદી જુદી ભૌગોલિક કઠિન પરિસ્થિતિઓ અને કડકડતી ઠંડી - અત્યન્ત ગરમી - વરસતા વરસાદ વગેરે જુદી જુદી ઋતુઓમાં ખુલ્લા ચરણારવિનંદથી અને માત્ર ધોતી-ઉપરણા ધારણ કરીને પદ્ધારવું તે આપશ્રીનું વિલક્ષણ સામર્થ્ય અને કર્તવ્યનિષ્ઠા બતાવે છે.

આપનું એક જ લક્ષ્ય હતું - જીવોને ભગવદ્ સમુખ કરવા અને શાસ્ત્રના પ્રામાણિક સિદ્ધાન્તોને જગતમાં સ્થાપિત કરવા.

તે લક્ષ્ય પ્રાપ્તિ માટે શ્રીવલ્લભે કેટલી પણ કપરી પરિસ્થિતિઓ હોય તેની પરવા કરી નથી. આચાર્યવર્ય શ્રીવલ્લભાચાર્યજીને માત્ર અને માત્ર જીવોના કલ્યાણની જ ચિન્તા હતી.

### ભગવાન્ શ્રીકૃષ્ણ દ્વારા દીક્ષામન્ત્રનું પ્રદાન

એક વખત શ્રાવણ સુદ એકાદશી (પવિત્રા એકાદશી) ના રાત્રિના શ્રીવલ્લભાચાર્યજી શ્રીગોકુલમાં શ્રીયમુનાજીના તટ પર વિશ્રાંમ કરી રહ્યા હતા. સાથે આપના પરમ શિષ્ય દામોદરદાસ હરસાનીજી પણ હતા.

તે સમયે શ્રીવલ્લભને ચિન્તા થઈ કે “પ્રભુની આજ્ઞા પ્રમાણે પુષ્ટિજીવોને ભગવદ્સેવા દ્વારા પ્રભુસંબંધી બનાવવા છે. પરન્તુ પ્રભુની સેવા માટે આવશ્યક શુદ્ધિ તો જીવમાં છે નહિ ! તો પછી તેવા દોષયુક્ત જીવનો પરમ ગુણવાન્ સર્વદોષ રહિત એવા પ્રભુ સાથે સંબંધ કેવી રીતે થઈ શકે ?”

શ્રીવલ્લભની જીવોના ઉદ્ધાર વિષયક આ ચિન્તાને દૂર કરવા માટે ભગવાન્ શ્રીકૃષ્ણ શ્રીવલ્લભની સામે સાક્ષાત્ પ્રકટ થયા અને શ્રીમહાપ્રભુજીને ‘બ્રહ્મસમ્બન્ધ મન્ત્ર’ પ્રદાન કરીને આજ્ઞા કરી કે “બ્રહ્મસમ્બન્ધ મન્ત્રની દીક્ષા આપીને જે જીવને આપ સેવા

## ॥ શ્રીવલ્લભચારિત્ર ॥



યોધ્ય બનાવશો તેની સેવા હું અંગીકાર કરીશ અને તેને પોતાનો માનીશ; તેને છોડીશ નહિ.''


શ્રીવલ્લભ ભગવાન् શ્રીકૃષ્ણ પાસેથી જીવના ઉદ્ઘારનો ઉપાય પ્રાપ્ત કરીને અત્યન્ત પ્રસન્ન થયા. ત્યાર પછી શ્રીવલ્લભે પોતાના અનન્ય સેવક દામોદરદાસ હરસાનીજી ને પૂછ્યું 'દમલા ! તેં કઢુ સુન્યો ? (દમલા ! તે કંઈ સાંભળ્યું ?)

દામોદરદાસજીએ જવાબ આપ્યો 'મહારાજ ! સુન્યો તો સહિ પરિ સમુજ્યો નાહિ' (મહારાજ ; સાંભળ્યું તો ખરું પણ સમજાયું નાહિ)

ત્યારે શ્રીવલ્લભે દામોદરદાસજીને પ્રભુએ પ્રકટ થઈને કહેલી સર્વ આજ્ઞા કહીને સમજાવી અને સર્વપ્રથમ બ્રહ્મસમ્બન્ધદીક્ષા દામોદરદાસજીને આપી.

ત્યાર પછી વિવિધ સ્થાનો પર અનેક જીવોને શ્રીમહાપ્રભુજીએ બ્રહ્મસમ્બન્ધ દીક્ષા આપી. જે મને શ્રીમહાપ્રભુજી બ્રહ્મસમ્બન્ધ દીક્ષા આપતા તેઓ પૂછ્યા 'અબ હમારો કહા કર્તવ્ય હૈ ?'

ત્યારે શ્રીવલ્લભ ઉત્તર આપતા 'ભગવદ્સ્વરૂપ પધરાયે સેવા કરો.'



ત્યાર પછી અનેક પ્રસંગોમાં શ્રીમહાપ્રભુજીએ; તે વૈષણવને ઘરે બિરાજને તેમને સમ્પૂર્ણ ભગવદ્સેવાનો કમ સમજાવ્યો છે. આ રીતે શ્રીવલ્લભ; પોતાના શિષ્ય પ્રતિ આત્મીયતાથી તેમના સાચા અને સમ્પૂર્ણ માર્ગદર્શક બન્યા છે. શ્રીવલ્લભની કૃપાથી અનેક વૈષણવોની સેવાનો પ્રભુએ સ્વીકાર કર્યો.

### શ્રીનાથજીનું પ્રાકટ્ય

દૈવી જીવોના ઉદ્ઘાર માટે પરિભ્રમણ કરતા કરતા જ્યારે શ્રીમહાપ્રભુજી વ્રજ તરફ પધારી રહ્યા હતા ત્યારે માર્ગમાં જારખંડનો ગ્રહેશ આવ્યો. ત્યાં શ્રીગોવર્ધનનાથજીએ શ્રીવલ્લભને આજ્ઞા કરી કે 'અમે શ્રીગોવર્ધન પર્વત પર પ્રકટ થયા છીએ. આપ જલ્દીથી પધારીને અમારી સેવાનો કમ પ્રકટ કરો.'

॥ શ્રીવલ્લભચિત્ત્ર ॥



ત્યાર પછી શ્રીવલ્લભ  
આન્યોર પધાર્યા. ત્યાં એક ચોંતરા  
પર બિરાજયા હતા, ત્યારે  
આસપાસના વ્રજવાસીઓ આપના  
દર્શન કરીને કહેવા લાગ્યા, ‘આ તો  
કોઈ મોટા મહાપુરુષ છે. આવું તેજ  
કોઈ મનુષ્યના મુખ પર ન હોય.’ તે  
સમયે એક વ્રજવાસી સદૃષ્ટિ પડેઅને  
આવીને હાથ જોડીને શ્રીવલ્લભને કહ્યું, ‘સ્વામી ! કંઈક આરોગશો ?’ ત્યારે  
શ્રીવલ્લભની સાથે રહેલા કૃષ્ણાદાસ મેઘને કહ્યું, ‘આપશ્રી પોતાના શિષ્ય સિવાય કોઈનું  
ગ્રહણ કરતા નથી.’




સદૃષ્ટિની પત્ની નું નામ હતું ભવાની અને તેની પુત્રીનું નામ હતું નરો. નરો પર  
શ્રીનાથજી ખૂબ જ કૃપા કરતા. તે પ્રતિદિન સવાર સાંજ શ્રીગોવર્ધનનાથજીને દૂધ  
આરોગાવવા નિરિરાજજી પર જતી અને ત્યારેક કોઈ કામકાજ વ્યસ્ત હોવાને કારણે નરો  
ન જઈ શકતી તો શ્રીગોવર્ધનધર તેને બોલાવતા અને છતાંય ન જઈ શકતી તો સ્વયં તેના  
ઘરે પદ્ધારીને માંગીને દૂધ આરોગતા.

તે દિવસે શ્રીવલ્લભ પદ્ધાર્યા હતા તેથી નરો દૂધ આરોગાવવા ન જઈ શકી તો  
શ્રીનાથજીએ સાચ પાડીને તેને બોલાવી, ‘અરે નરો ! મહેમાન આવ્યા તે તો સારું થયું  
પણ મારી માટે દૂધ તો લાવ.’ ત્યારે નરો દૂધ લઈને ગઈ.

શ્રીવલ્લભે એ અવાજ સાંભળીને દામોદરદાસજીને કહ્યું, ‘દમલા ! પ્રભુ અહીં જ  
પ્રકટ થયા છે. તેથી સવારે ઉપર  
જઈશું.’

પછી શ્રીગોવર્ધનનાથજીને  
દૂધ આરોગાવીને નરો પાછી આવી  
ત્યારે શ્રીવલ્લભે કહ્યું ‘આમાં કંઈ  
બચ્યું હોય તો અમને હે.’

નરો કહે, ‘હા મહારાજ !  
પણ થોડુંક જ બચ્યું છે, ઘરમાં દૂધ  
ઘણું છે. વધારે લઈ આવું ?’





## ॥ શ્રીવલ્લભચાર્ટ્ર ॥

શ્રીવલ્લભે કહ્યું ‘ના; બીજું તો નથી જોઈતું, આ થોડુંક જ લાવ.’ અને શ્રીવલ્લભે એ પ્રસાદી દૂધ ગ્રહણ કર્યું.

ત્યાર પછી સદુ પાડે ; પરિવાર સહિત શ્રીવલ્લભના શરણે આવ્યા.

સવારે સ્નાન કરીને શ્રીવલ્લભ સર્વ વૈષ્ણવોને સાથે લઈને શ્રીગિરિરાજજી ઉપર પદ્ધાર્યા. શ્રીવલ્લભને પદ્ધારતા જોઈને શ્રીગોવર્ધનનાથજી અત્યન્ત ઉર્ભિત થઈને સામા પદ્ધાર્યા. બન્ને સ્વરૂપ મળ્યા ત્યારે ખૂબ જ પ્રસન્ન થયા.

શ્રીગોવર્ધનનાથજીએ શ્રીમહાપ્રભુજીને આજ્ઞા કરી કે ‘આપ મારી સેવાનો કમ પ્રકટ કરો.’

ત્યારે શ્રીવલ્લભે એક નાનકડું મંદિર સિદ્ધ કરાવીને શ્રીનાથજીને પાટ બિરાજાવ્યા અને અપ્સરા કુંડ ઉપર એક ગુફામાં રહેતા રામદાસ ચૌહાન જે શ્રીવલ્લભને શરણે આવ્યા હતા તેમને સેવાનો કમ શિખવાડીને શ્રીનાથજીની સેવા કરવાની આજ્ઞા કરી.

## શ્રીસુભોગિનીલેખન તથા અન્ય ગ્રન્થો

પરિભ્રમણના અતિ વ્યસ્ત કાર્યક્રમની સાથે સાથે શ્રીવલ્લભાચાર્યજીને; ‘શ્રીમદ્ભાગવત’ પર વિવરણ લખવાનું અતિશય મહત્વનું કાર્ય પણ કરવાનું હતું.

એક વખત જ્યારે શ્રીવલ્લભાચાર્યજી વૃન્દાવનમાં બિરાજતા હતા ત્યારે તેઓશ્રીનિમબાઈ સમ્પ્રદાયના આચાર્ય શ્રીકિશબ્દહૃ કાશ્મીરી આવ્યા. તેમની સાથે તેમના શિષ્ય માધવભરુ કાશ્મીરી પણ હતા.

તે સમયે શ્રીવલ્લભાચાર્યજી શ્રીમદ્ભાગવતનું પારાયણ કરી રહ્યા હતા. તેથી કેશવભરુ અને માધવભરુ; બન્નેએ શ્રીવલ્લભાચાર્યજીના શ્રીમુખથી શ્રીમદ્ભાગવતનું શ્રવણ કર્યું.

માધવભરુ કાશ્મીરીને શ્રવણ કરતા અતિશય આનંદ

નો અનુભવ થયો અને તેઓને


સદા શ્રીવલ્લભની નિકટ રહેવાની

ઇરણા થઈ.

કેશવભરુ કાશ્મીરીએ પણ તેમની

ઇરણા જાણીને તે મને

શ્રીમહાપ્રભુજીને ભેટ કર્યા.





માધવભણું સારા શ્રોતા અને સારા લિપિક પણ હતા. તેમના અક્ષર ખૂબ જ સુંદર થતા.

શ્રીવલ્લભને પણ અનુકૂલતા થઈ; આપશ્રી ‘સુભોધિની’ લખાવે અને માધવભણું કાશીરી લખતા જાય.

હવે લેખન કાર્ય વેગથી થવા લાગ્યું. માધવભણું સમજું સમજુને લખતા; કોઈ વાત ન સમજાય તો શ્રીવલ્લભ તેનું વિવરાણ કરીને સમજાવતા.

શ્રીવલ્લભભાચાર્યજીએ અન્ય પણ અનેક ગ્રન્થોની રચના કરી છે. પોતાના અનુયાયીઓને કર્તવ્ય અને સિદ્ધાન્ત ની સમજ આપવા માટે આપશ્રીએ નાના નાના ૧૬<sup>૧</sup> ગ્રન્થોની રચના કરી. જે ‘ષોડશગ્રન્થ’ રૂપે પ્રસિદ્ધ છે.

આ સિવાય પણ તત્ત્વાર્થદીપનિબન્ધ, શ્રીબ્રહ્મસૂત્ર-અણુભાષ્ય, ગાયત્રીભાષ્ય, ત્રિવિધલીલાનામાવલી, શ્રીપુરુષોત્તમસહસ્રાનામસ્તોત્ર, પત્રાવલંબન વગેરે અનેક ગ્રન્થોની રચના આપશ્રીએ કરી.

### શાસ્ત્રાર્થમાં વિજય અને કનકાભિષેક

ભારતીય ધર્મશાસ્ત્રો અને તત્ત્વવિચાર શાસ્ત્રો ના યથાર્થ તાત્પર્યને પ્રકટ કરવા માટે વિદ્વાનો વચ્ચે શાસ્ત્રચર્ચાઓ થતી અને ચર્ચાના અન્તે ધર્મ અને તત્ત્વ ના સિદ્ધાન્ત પ્રસ્થાપિત થતા.

શ્રીવલ્લભભાચાર્યજી ભારતભ્રમણ કરતા કરતા અનેક સ્થાનો પર શાસ્ત્રચર્ચાઓ દ્વારા સિદ્ધાન્તની સ્થાપના નું મહાન् ઉત્તરદાયિત્વ પરિપૂર્ણ કરી રહ્યા હતા.

તે સમયે કેટલાક માયાવાદી બ્રાહ્મણોએ સરસ્વતીદેવીની આરાધના કરીને તેમને વશમાં કર્યા હતા. તેથી તેઓ જ્યાં જાય ત્યાં સરસ્વતીજનો ઘટ મુકે અને ચર્ચા પછી સરસ્વતીજ પાસે બોલાવે કે ‘આ બ્રહ્મણો નો મત સાચો છે.’ એમ કરીને વાદમાં તેઓને કોઈ જીતી શકતું નહિ.

એક વખત આપશ્રી ઉજાજૈન પાસે ઓડછા પદ્ધાર્યા હતા. તે વખતે ઓડછા દેશના રાજા રામભરનારાયણ ને ત્યાં બ્રાહ્મણોની સભા ભેગી થઈ





## ॥ શ્રીવલ્લભચરિત્ર ॥

હતી. શ્રીવલ્લભે જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે આપશ્રી તે સભામાં પદ્ધાર્યા. રાજા આપશ્રીના દર્શન કરીને અત્યન્ત પ્રસન્ન થયા અને આપને ઉંચા આસન પર બિરાજાવ્યા.

ત્યાર પછી માયાવાદી બ્રાહ્મણો સાથે શ્રીવલ્લભે શાસ્ત્રચર્ચાનો પ્રારંભ કર્યો. બ્રાહ્મણોએ કહ્યું - આ ઘટમાં સરસ્વતીજી છે તેઓ જે કહે તે સાચું. શ્રીવલ્લભે કહ્યું, ‘ભલે; તમે સરસ્વતીજી પાસે બોલાવો.’ બ્રાહ્મણોએ ઘટને વિનન્તી કરી; પરન્તુ ઘટમાંથી સરસ્વતીજી તો બોલ્યા જ નહિ. ત્યારે શ્રીવલ્લભે રાજને કહ્યું કે ‘આ સર્વ તો છલ કરીને ચર્ચામાં વિજય પ્રાપ્ત કરે છે. વૈષ્ણવમાર્ગ તો સર્વોપરી છે.’

ત્યારે બ્રાહ્મણોએ સરસ્વતીજીને પૂછ્યું ‘તમે અમારું અપમાન કેમ કરાવ્યું?’ સરસ્વતીજીએ તેમને જણાવ્યું કે ‘અરે દુષ્ટો ! કોઈ મનુષ્ય હોય તો તેની સામે તો હું બોલું. સાક્ષાત् વાક્યપતિ કે જેના કંઠાગ્રમાં હું રહું છું તેમની સામે હું કેમ બોલું ? (કેમકે શ્રીવલ્લભ જે કહે છે તે જ સાચું છે)’

સમસ્ત રાજસભામાં શ્રીવલ્લભનો જ્યાયજ્યકાર થઈ રહ્યો. રાજાએ વિચાર્યુ કે ‘મારા ધન્ય ભાગ્ય છે કે પૂર્ણ પુરુષોત્તમ મારા ધરે પદ્ધાર્યા.’ તે પછી રાજા અને અનેક દૈવીજીઓ શ્રીવલ્લભને શરાણે આવ્યા. રાજાએ શ્રીવલ્લભનો કનકાભિષેક કરાવ્યો. શ્રીવલ્લભની આજ્ઞાથી તે સ્નાનના સુવાર્ણનું દ્રવ્ય બ્રાહ્મણ બાલકોના યજ્ઞોપવીત અને બ્રાહ્મણ કુમારિકાઓના વિવાહમાં ઉપયોગ કરવામાં આવ્યો.

### સ્વમતસ્થાપન તથા પત્રાવલંબનની રચના

શ્રીવલ્લભભાચાર્યજીએ વેદ-શ્રીમદ્ભગવદ્ગીતા-બ્રહ્મસૂત્ર-શ્રીમદ્ભાગવત આદિ સર્વ શાસ્ત્રોનું મનન પૂર્વક સર્વશાસ્ત્રવચનોની એકવક્ષયતા કરીને ‘સાકાર બ્રહ્મવાદ’ નો તત્ત્વસિદ્ધાન્ત પ્રસ્થાપિત કર્યો; જે પછીથી ‘શુદ્ધાદ્વિતવાદ’ નામથી પણ ઓળખાયો.

સાકાર બ્રહ્મવાદના સિદ્ધાન્ત દ્વારા આ ભૂતલ પર જ શ્રીવલ્લભભાચાર્યજીએ પુષ્ટિજીવો ને ‘પ્રભુ’ શ્રીકૃષ્ણ પ્રાપ્ત કરાવ્યા છે તેથી આપશ્રી શ્રીમહાપ્રભુજી તરીકે પણ પ્રસિદ્ધ થયા.

શ્રીવલ્લભભાચાર્યજી દ્વારા સ્થાપિત સિદ્ધાન્તોને સંક્ષેપમાં જોઈએ તો -





પરં બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન् શ્રીકૃષ્ણ છે.

શ્રીકૃષ્ણ ભગવાને પોતાનામાંથી જ આ સર્વ સૃજિ (૪૩-ચેતન તત્ત્વો ) ની રચના કરી છે.

સૃજિમાં પ્રભુએ વિવિધ પ્રકારના જીવો રચ્યા છે. તેમાં વિશેષ કૃપા જેમની પર છે; તે પુષ્ટિ જીવો છે.

ભગવાન् શ્રીકૃષ્ણની શરાણાગતિ - ભક્તિ ને અનુસારી જીવન જીવવું તે પુષ્ટિ જીવોનું મુખ્ય કર્તવ્ય છે.

આપશ્રી જ્યારે કાશીમાં નિવાસ કરતા હતા ત્યારે ત્યાં દેશના ખૂંડો ખૂંડેથી વિદ્વાન પંડિતો આપશ્રીની સાથે શાસ્ત્રચર્ચા કરવા આવતા.

પ્રતિદિન શાસ્ત્રચર્ચા કરવામાં ઘણો સમય વ્યતીત થતો અને એક જ વાત પુનઃ પુનઃ અનેક વ્યક્તિઓને કહેવા કરતા શ્રીવલ્લભભાચાર્યજીએ એક ઉપાય કર્યો. આપશ્રીએ પોતાનો મત ‘પત્રાવલંબન’ નામથી લખીને કાશીવિશ્વનાથના મંદિરમાં લગાવડાવી દીધો.

પત્રાવલંબનમાં સિદ્ધાન્તવિષયક ચર્ચા કર્યા પછી સમાપનમાં આપશ્રીએ લખ્યું કે - ‘કાશીવિશ્વનાથના મંદિરમાં મેં ડિઝિમ્પોષ કર્યો છે. જેના સાક્ષિ મહાદેવજી છે. જો કોઈને હવે શાસ્ત્રના તાત્પર્યના વિષયમાં સંદેહ હોય તો મને આવીને પૂછી શકો છો.’

આ રીતે પત્રાવલંબન દ્વારા શ્રીવલ્લભભાચાર્યજીએ અનેક પંડિતોને નિરૂત્તર કર્યા. તે પછી પણ જેમને કોઈપણ ચર્ચા કરવી હોય તો તેઓ શ્રીવલ્લભ પાસે આવતા અને આપશ્રી તેમનું સમાધાન કરતા.

### શ્રીવલ્લભભાચાર્યજીનો પરિવાર

શ્રીવલ્લભભાચાર્યજી એક વખત પંઢરપુર પદ્ધાર્ય હતા. ત્યાં બિરાજતા પ્રભુ પાંહુરંગ શ્રીવિઠ્ઠલનાથજીના દર્શન કરવા પદ્ધાર્ય. ત્યારે શ્રીવિઠ્ઠલનાથજીએ શ્રીવલ્લભને આજ્ઞા કરી કે ‘ભક્તિમાર્ગનો પ્રચાર આગળ પણ થતો રહે તે માટે અમારે આપને ત્યાં પ્રકટ થવું છે તેથી આપ વિવાહ કરો.’

ભગવદજ્ઞાને અનુસરીને શ્રીવલ્લભભાચાર્ય વિવિધ પ્રમાણે શુભ મુહૂર્તમાં કાશીમાં શ્રીમધુમંગલજી ના સુપુત્રી શ્રીમહાલક્ષ્મીજી સાથે વિવાહ કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો.





## ॥ શ્રીવલ્લભચાર્યજીને ત્યાં બે પુત્ર નું પ્રાકટ્ય થયું. પ્રથમ પુત્ર શ્રીગોપીનાથજીનું પ્રાકટ્ય વિક્રમ સંવત् ૧૫૬૭ માં અડેલમાં થયું. દ્વિતીય પુત્ર શ્રીવિષ્ણુલનાથજી (શ્રીગુંસાંધજી) નું પ્રાકટ્ય વિક્રમ સંવત્ ૧૫૭૨ માં ચરણાટમાં થયું.

બન્ને બાલકો નાનપણથી જ ભગવદ્દસ્વરૂપમાં આસક્તિ વાળા હતા.

શ્રીવિષ્ણુલનાથજી બાલક હતા ત્યારનો એક પ્રસંગ છે; શ્રીમહાપ્રભુજીએ શ્રીવિષ્ણુલનાથજીને રમવા માટે શ્રીબાલકૃષ્ણજીનું સ્વરૂપ પદ્મરાવી આપ્યું હતું. તેમને ભોગ ધરવા માટે એક ઠોર પ્રતિદિન આપવામાં આવતો. એક વખત શ્રીવિષ્ણુલેશજીએ ઠોર ભોગ ધર્મો ત્યારે શ્રીબાલકૃષ્ણ પ્રભુ તે ઠોર લઈને આરોગ્યવા લાયા. તે વખતે નાના બાલક શ્રીવિષ્ણુલનાથજીએ વિચાર્યુંકે ‘જો શ્રીબાલકૃષ્ણજી આખો ઠોર આરોગ્યી જશે તો મને તો કંઈ મળશે જ નહિ !’ તેથી તેમણે શ્રીબાલકૃષ્ણજીનો હાથ પકડી લીધો. હવે તો મજાની રમત શરૂ થઈ; આ બાજુ શ્રીઠકૃરજી ઠોર ખેંચે બીજી બાજુ શ્રીવિષ્ણુલનાથજી ખેંચે. શ્રીમહાપ્રભુજીએ આ બાલકીડા જોઈ અને અત્યન્ત પ્રસન્ન થયા. પછી આપશ્રીએ શ્રીવિષ્ણુલેશજીને કહ્યું, ‘આ તો લડાકુ (નટખટ) ઠાકુર છે તમે તેમને પહોંચી નહિ શકો. હવેથી તમને બે ઠોર આપવામાં આવશે એક શ્રીબાલકૃષ્ણજીનો અને એક તમારો.’

આ રીતે શ્રીવલ્લભના બાલકોની બાલકીડા પણ સાત્ત્વિક, ધર્મનિષ્ઠ અને ભગવદ્દભક્તિભાવથી પરિપૂર્ણ હતી.

બન્ને શ્રીવલ્લભનન્દન; શ્રીગોપીનાથજી તથા શ્રીવિષ્ણુલનાથજીમાં પરસ્પર અત્યન્ત સ્નેહભાવ હતો. ભગવદ્દસેવાનો કમ તથા ગ્રન્થપાઠનો કમ બન્ને બાલકો સાથે રહીને હળીમળીને કરતા.

બન્ને બાલકોએ નાની વયમાં જ સર્વ શાસ્ત્રોનું અધ્યયન કરી લીધું હતું.

મોટા થઈને શ્રીગોપીનાથજી અને શ્રીવિષ્ણુલનાથજીએ શ્રીવલ્લભને અનુસરીને લોકમાં ભક્તિમાર્ગનો પ્રચાર કર્યો અને શ્રીવલ્લભનું કાર્ય આગળ વધાર્યું. બન્ને આચાર્યોએ વિવિધ ગ્રન્થોની રચના કરીને પુષ્ટિગ્રન્થસાહિત્યને સમૃદ્ધ કર્યું.



॥ શ્રીવલ્લભચિત્ત્ર ॥



## શ્રીપુરુષોત્તમસહસ્રનામની રચના - વૈષણવોને શ્રેષ્ઠ જીવન માટેની પ્રેરણા

શ્રીવલ્લભના મોટા પુત્ર શ્રીગોપીનાથજી નો પ્રતિદિનનો એવો નિયમ હતો કે સમ્પૂર્ણ શ્રીમદ્ભાગવતનો પાઠ કરીને જ ભોજન કરવું. શ્રીમદ્ભાગવત બૃહદ્ (મોટો) ગ્રન્થ છે. તેમાં ૧૮૦૦૦ શ્લોક છે. તેથી સમ્પૂર્ણ શ્રીમદ્ભાગવતનો પાઠ કરવામાં ઘણો સમય લાગે. તે કારણે શ્રીગોપીનાથજી ભોજન પણ બે ત્રણ દિવસે કરતા.



શ્રીગોપીનાથજીના આ પરિશ્રમનું નિવારણ થાય અને તેમનો નિયમ પણ સંચચાય તે માટે શ્રીમહાપ્રભુજીએ 'શ્રીપુરુષોત્તમસહસ્રનામ સ્તોત્ર'ની રચના કરી; જેના પાઠથી શ્રીમદ્ભાગવતના પાઠ કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે.

તે જ રીતે શ્રીવલ્લભે પોતાના નાના પુત્ર શ્રીવિકુલનાથજી માટે શ્રીમદ્ભાગવતના દશમ સ્કન્ધના અર્થ રૂપ ત્રિવિધલીલાનામાવલી ની પણ રચના કરી. આ રીતે શ્રીવલ્લભે પોતાના બન્ને પુત્રોને ભક્તિમાર્ગનિષ્ઠાનું દાન કર્યું.

શ્રીવલ્લભભાચાર્યજીના અનેક શિષ્ય થયા. જેમાંથી ૮૪ વૈષણવોની વાર્તા પ્રસિદ્ધ છે. આપશ્રી અત્યન્ત કાળજીપૂર્વક અને આત્મીયતાના ભાવ થી પોતાના શિષ્યોને શ્રેષ્ઠ માર્ગનો બોધ આપતા.

આપશ્રીના શિષ્યોમાં પણ ખૂબ જ જ્ઞાસાવૃત્તિ રહેતી. તેઓ શ્રીવલ્લભને પોતાના કર્તવ્યના વિષયમાં પૂછતા કે 'અબ હમારો કહા કર્તવ્ય હૈ ?' ત્યારે આપશ્રી જેમનો જેવો અધિકાર હોય તે પ્રમાણે ભગવદ્ભક્તિસેવા, ભગવદ્શરણાત્તિ વગેરે કર્તવ્યોનો ઉપદેશ આપતા.

શ્રીવલ્લભ પોતાની સાથે રહેતા વૈષણવોનું પોતાના બાળકની જેમ ધ્યાન રાખતા. વૈષણવોને ઘરે પદ્ધારીને ત્યાં કેટલોક સમય રોકાઈને તેમને ભગવદ્ભક્તિસેવાનો કમ પણ શીખવતા.



પોતાના શિષ્યોનું જીવન સાત્ત્વિક, ધર્મનિષ્ઠ અને ભગવદ્ભક્તિથી ઓતપ્રોત બને તે માટે આપ સતત પ્રયત્નશીલ રહેતા.



## શેઠ પુરુષોત્તમદાસને ત્યાં નન્દમહોત્સવ

કાશીના નગરશેઠ પુરુષોત્તમદાસ શ્રીમહાપ્રભુજીના શિષ્ય હતા. તેઓ શ્રીમદનમોહનજીની સેવા કરતા.

એક વખત શ્રીમહાપ્રભુજી કાશીમાં શેઠ પુરુષોત્તમદાસને ત્યાં પદ્ધાર્ય.


શ્રીમહાપ્રભુજી ત્યાં બિરાજતા હતા તે સમયમાં જન્માણ્ટમીનો ઉત્સવ આવ્યો. ત્યારે શ્રીઆચાર્યચરાણે નન્દરાયજીને ત્યાં જે રીતે નન્દમહોત્સવ થયો હતો તે ભાવથી શ્રીદાકૃરજીને પલનામાં પદ્ધરાવી નન્દમહોત્સવ કર્યો.

જ્યારે શ્રીમહાપ્રભુજી ઉત્સવ કરી રહ્યા હતા ત્યારે નન્દરાયજી, યશોદાજી, ગોપી જ્વાલ સાક્ષાત્ પદ્ધાર્ય અને અનિર્વચનીય નન્દમહોત્સવ થયો.

આ ઉત્સવ અને સાક્ષાત્ નન્દરાયજી-યશોદાજી-ગોપી-જ્વાલના દર્શન નો અલૌકિક આનન્દ, શેઠ પુરુષોત્તમદાસ અને તેમના પરિવારને પ્રાપ્ત થયો.

ઉત્સવ સમ્પન્ન થયા પછી શ્રીવલ્લભે યશોદાજી-ગોપી-જ્વાલને કહ્યું ‘આ કાલમાં આપ સાક્ષાત્ પદ્ધાર્ય તે ઉચિત નથી (કિમે આપના દર્શનનો અધિકાર બધાને નથી તેથી) હવે અમે આપના વેશ ધરાવીશું તેમાં પદ્ધારજો.

ત્યારે સહુએ કહ્યું  
‘ભલે હવે અમે; આપ વેશ  
ધરાવશો તેમાં પદ્ધારીશું.’



ત્યારથી પુણિમાર્ગીય  
ભગવત્સેવાના કમમાં  
નન્દમહોત્સવના ઉત્સવ પર  
નન્દરાયજી, યશોદાજી, ગોપી,  
જ્વાલના વેશ ધારણ કરવાની  
રીત સ્થાપિત થઈ.

આ રીતે શ્રીમહાપ્રભુજીએ પ્રથમ શ્રીકૃષ્ણજન્મમહોત્સવ શેઠ પુરુષોત્તમદાસને ત્યાં કર્યો. ત્યાર પછી શેઠ પુરુષોત્તમદાસ નિત્ય શ્રીમદનમોહનજીને પાલને જુલાવતા અને જન્મ ઉત્સવના ભાવમાં મગન રહેતા.



## શ્રીદ્વારિકાધીશજુનું પ્રાકટ્ય

એક સમયે શ્રીવલ્લભભાચાર્યજી દ્વારિકા પદ્ધાર્યા હતા.

ત્યારે આપશ્રીના તેજથી પ્રભાવિત થઈને ત્યાંના બ્રાહ્મણો આપશ્રી પાસે આવ્યા અને વિનન્તી કરી કે - ‘મહારાજ; અહીં વજનાભજ દ્વારા સ્થાપિત ભગવદ્સ્વરૂપ તો બોડાના ભક્ત પર પ્રસન્ન થઈને ડાકોરમાં બિરાજ્યા છે. હવે અહીંનું મંદિર ખાલી છે. તેથી આપ ભગવદ્સ્વરૂપ પદરાવો.’

શ્રીવલ્લભે કહ્યુંકે ‘આજ વિચાર કરીને કાલે કહીશ.’

રાત્રે આપ વિચારમાં બિરાજ્યા હતા ત્યારે શ્રીદ્વારિકાધીશજી પ્રભુ પ્રકટ થયા.

શ્રીદ્વારિકાધીશજીએ પ્રકટ થઈને આજ્ઞા કરી કે, ‘શ્રીરૂક્મિણીજ દ્વારા સેવ્ય અમારી મૂર્તિ અહીં (પાસે જ) રૂક્મિણીવનમાં પૃથ્વીતલમાં બિરાજે છે અને તેની પાસે તે સમયના ત્રણ રત્નો છે. એક તો દિવ્ય શંખ છે, બીજું માણેકનો ડિરીટ છે અને ત્રીજી એક કટાર છે.

આ મૂર્તિ દુર્વાસા ઋષિના શાપથી શ્રીરૂક્મિણીજને ૧૨ વર્ષ સુધી અમારો વિયોગ થયો હતો ત્યારે તેઓએ આ મૂર્તિનું પૂજન કર્યું હતું.



પછી જ્યારે અમારો સંયોગ

થયો ત્યારે શ્રીરૂક્મિણીજએ; વિયોગ સમયે જે સ્થલ પર બિરાજ્યા હતા તે સ્થલમાં, આ મૂર્તિને પૃથ્વીમાં પદરાવી દીધા હતા. એ સ્વરૂપને આપ પદરાવો.’

એમ આજ્ઞા કરીને શ્રીદ્વારિકાધીશ પ્રભુ અન્તર્ધ્યાન થયા.

બીજે દિવસે શ્રીવલ્લભભાચાર્યજી; એ બ્રાહ્મણોને સાથે લઈને તે સ્થાનમાં પદ્ધાર્યા અને પ્રભુની આજ્ઞા અનુસાર ત્રણેય વરસ્તુઓ સહિત ભગવદ્સ્વરૂપને પદરાવીને દ્વારિકાના પ્રાચીન મંદિરમાં સ્વરૂપ પ્રતિષ્ઠા કરી તથા સેવાનો કમ પ્રારંભ કરાવ્યો.

ત્યાર પછી કાલકર્મે એ ભગવદ્સ્વરૂપ શંખોદ્વાર (બેટ-દ્વારિકા) માં પદ્ધાર્યા અને અધારિત ત્યાં શ્રીદ્વારિકાધીશ મંદિરમાં બિરાજે છે.



## ભગવન્નામનું માહાત્મ્ય

શ્રીવલ્લભાચાર્યજી તીર્થક્ષેત્રોની યાત્રા કરતા કરતા દક્ષિણ ભારતના વિષ્ણુકાંચી ક્ષેત્રમાં પધાર્યો. વિષ્ણુકાંચીમાં શ્રીવરદ્રાજસ્વામીનું ભવ્ય મંદિર આવેલું છે.

શ્રીવલ્લભ; મંદિરમાં પધારી રવ્યા હતા ત્યારે મંદિરમાં જવાના પગથિયા પર આપશ્રીએ જોયું કે મહાનું ભગવદ્બક્ત કવિ શ્રીજયદેવજીએ રચેલ 'ગીતગોવિન્દ' ની અષ્ટપદીઓ કોતરેલી હતી.

ત્યારે સાથે રહેલા દામોદરદાસ હરસાનીજીને આપશ્રીએ કહું કે 'ભગવન્નામ પણ ભગવદ્સ્વરૂપ ની જેમ જ માહાત્મ્યશાલી છે. તેથી તેને પગ લગાડીએ તો તે મોટો દોષ છે.'

આમ કહી શ્રીવલ્લભે શ્રીવરદ્રાજસ્વામીને ત્યાંથી જ પ્રણામ કર્યા. શ્રીવરદ્રાજસ્વામીએ જાણ્યું કે - 'શ્રીવલ્લભ મંદિરમાં પોતાની પાસે નહિ પધારે'

ત્યારે તેઓ સ્વયં સામેથી શ્રીવલ્લભની પાસે પધાર્યા અને શ્રીવલ્લભનો શ્રીહસ્ત પકડીને આ અષ્ટપદી જે ચોવીસ પગથિયામાં છે ત્યાં ચરણ ન પડે તે રીતે શ્રીમહાપ્રભુજીને પદરાવીને પોતાના મંદિરમાં લઈ ગયા.

આ રીતે ભગવન્નામ તથા ભગવદ્સ્વરૂપ બન્ને એકરૂપ છે તેમનું સમ્માન કરવું તેવો બોધ આ પ્રસંગ દ્વારા શ્રીવલ્લભે આપ્યો.



## શ્રીવલ્લભાચાર્યજી વૈષ્ણવો માટે સદા બિરાજે છે

શ્રીમહાપ્રભુજીને પ્રભુએ આજ્ઞા કરી કે "હવે આપ ભૂતલ પરથી પાછા નિત્ય લીલામાં પધારો." ત્યારે માર્ગપ્રચારનું કાર્ય શ્રીગોપીનાથજી, શ્રીગુસાંહિજીને સૌંપી શ્રીમહાપ્રભુજીએ કાશીમાં ગંગાજીના તર પર સંન્યાસ ગ્રહણ કર્યો.

તે સમયે શ્રીગોપીનાથજી તથા શ્રીવિષ્ણુનાથજી આપશ્રીની પાસે આવ્યા અને પૂછ્યું 'હવે અમારે શું કર્તવ્ય છે ?' ત્યારે શ્રીવલ્લભે મૌનક્રત ધારણ કરેલું હોવાથી જમીન પર સાડા ત્રાણ શલોક લખીને ઉપદેશ આપ્યો તે ઉપદેશ 'શિક્ષાશલોકી' નામે ગ્રસિદ્ધ છે.



## ॥ શ્રીવલ્લભાયાર્થિત્ર ॥

ત્યાર પછી શ્રીવલ્લભાચાર્યજીએ ગંગાજીમાં પ્રવેશ કર્યો અને ત્યાં ઉપસ્થિત લોકોએ આકાશમાં જતા તેજપુંજને જોયો. જ્યારે કાશીમાં આપશ્રીએ સંન્યાસ ગ્રહણ કર્યો ત્યારે એક વૈષણવ અત્યન્ત દુઃખી થયા ત્યારે શ્રીમહાપ્રભુજીએ કહ્યું ‘તુ દુઃખી ન થજે અચ્યુતદાસ પાસે જજે.’

અચ્યુતદાસ  
શ્રીમહાપ્રભુજીના  
કૃપાપાત્ર વૈષણવ હતા.  
તેઓ શ્રીમહાપ્રભુજીના  
પાદુકાજીની નિત્ય સેવા  
કરતા. ત્યાર પછી તે  
વૈષણવ અચ્યુતદાસ પાસે  
ગયા અને સર્વ સમાચાર કર્યા.



ત્યારે અચ્યુતદાસે કહ્યું ‘શ્રીમહાપ્રભુજી ભૂતલ નો ત્યાગ કરે જ નહિ તને ભ્રમ થયો હશે, જો હમણા જ ઉત્થાપનના સમય થશે તારા સર્વ સંદેહ દૂર થશે.’

ત્યાર પછી ઉત્થાપન કરાવીને મંદિરના દરવાજા ખોલ્યા અને તે વૈષણવને બોલાવ્યા તેમણે આવીને જોયું અને આશ્રય પામ્યા. શ્રીમહાપ્રભુજી તો ત્યાં બિરાજને શ્રીભાગવતજીનું વાંચન કરી રહ્યા છે. ત્યારે તે વૈષણવે દંડવત્ પ્રણામ કર્યા, શ્રીમહાપ્રભુજીએ આજ્ઞા કરી ‘તું સંદેહ ન કર, કાશીમાં જે તુ જોઈ આવ્યો તે તો લૌકિક લીલા હતી. ભક્તના ઘરમાં તો હું સદા જ બિરાજું છું.’

તેથી પોતાના અનુયાધીજનો માટે તો આપશ્રી શ્રીબેંકજી, સ્વગ્રન્થો, સેવ્ય આદિ સ્વરૂપે સદા બિરાજે જ છે. આવા આપણા પ્રેરક - પથપ્રદર્શક ગુરુવર્ય શ્રીવલ્લભાધીશજીને અનેકશા: વન્દન.

આપના દ્વારા પ્રવર્તિત માર્ગને અનુસરીને આપણા જીવનને સાર્થક કરીએ....

શ્રીવલ્લભાધીશ કી જ્ય ....

॥ શ્રીવલલભચારિત્ર ॥



પુષ્ટિભક્તિમાર્ગ-પ્રવર્તક સાડારબહુવાદ-સ્થાપક આચાર્યર્વ્ય  
શ્રીમહાપ્રભુજી શ્રીવલલભાચાર્યજી

॥ श्रीवल्लभयटित्र ॥



श्रीपुष्टिसंस्कार संस्थान, मोटी हवेली-जूनागढ  
संचालित

## श्रीपुष्टिसंस्कार पाठशाला

आशिर्वाद

गोस्वामी श्रीकिशोरचन्द्रजी महाराजश्री

अध्यक्ष

गोस्वामी श्रीपीयूषकुमारजी महोदय

आज प्रत्येक व्यक्ति अपने बच्चोंको शिक्षित करने के प्रति अत्यन्त जागृत है. इसी के साथ वह संस्कारों के मूल्य को भी स्वीकार रहा है. विश्व विकास का बीज मानव चेतनामें निहित है. यदि मानवमन सुंदर सात्त्विक होगा तब हि समाजमें शान्ति एवं उन्नति संभव होगी. स्वस्थ मानवमनका निर्माण बाल्यावस्थासे हो यह आवश्यक है.

पुष्टिसंस्कार पाठशाला के द्वारा बाल संस्कार का यह आवश्यक कार्य सम्पन्न हो रहा है.

आज १०० से भी अधिक गांवोंमें पुष्टिसंस्कार पाठशाला के केन्द्र कार्यरत हैं. पाठशालामें बालकोंके द्वारा शुद्ध उच्चार सहित संस्कृत श्लोकोंका पठन किया जाता है. पाठशाला संचालक उन्हे धर्म इतिहास की जानकारी, सात्त्विक जीवन एवं दिनचर्या का बोध कराते हैं. बच्चोंको गोसेवा की प्रेरणा दी जाती है. श्रीवल्लभाचार्यजी के द्वारा उपदिष्ट सिद्धान्तोंको जीवनमें उतारने की प्रेरणा दी जाती है. राष्ट्रप्रेम, पर्यावरण शुद्धि, व्यसनमुक्ति, सत्यवचन, सत्संग आदि का महत्त्व समजाया जाता है. धार्मिक परीक्षा आयोजन, विविध स्पर्धा आयोजन एवं सांस्कृतिक कार्यक्रमों के द्वारा बालकोंको प्रोत्साहित किया जाता है.



प्रत्येक बालक का सर्वांगपूर्ण विकास - पुष्टिसंस्कार पाठशाला का लक्ष्य है.

## ॥ શ્રીવલલભચરિત્ર ॥

પુષ્ટિ પબ્લિકેશન - જૂનાગઢ

હોન : ૦૨૮૫ - ૨૬૨૧૧૧૧, મો. ૯૬૩૮૦ ૨૬૪૫૬ | [www.pushtipublication.com](http://www.pushtipublication.com)